

ઔદ્યોગિક ન્યાયપંચ, કોર્ટ નં.૪ ના પ્રમુખ અધિકારી શ્રી એચ. એ. ભુતવાલા અમદાવાદ સમક્ષ.

રેકૉર્ડ્સ (આઈ.ટી.) નં.૯૩/૨૦૨૦.

પ્રથમ પક્ષકાર/સામાવાળા : (૧) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
સરદાર પટેલ ભવન, દાણાપીઠ,
અમદાવાદ-૩૮૦ ૦૨૨.

વિરુદ્ધ

બીજા પક્ષકાર/અરજદાર : મેનહોલ કામદાર યુનિયન,
ભારત નગર, ગીતા મંદિર રોડ,
અમદાવાદ-૨૨.

પ્રથમ પક્ષકાર તરફે : વિ. વ. શ્રી મિલન દવે.
બીજા પક્ષકાર તરફે : પ્રતિનિધી શ્રી જે.એમ.સોલંકી.

: આંક-૧૬ ની દસ્તાવેજો માંગતી અરજી લગત હુકમ :

૧. આ કામે અરજદારે આ અરજી આપી સામાવાળા સંસ્થા પાસે (૧) બીજા પક્ષકાર વારસદારની નોકરી મેળવવાની ચાલેલ સંપૂર્ણ ફાઈલ (૨) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સક્ષમ સત્તાની મંજૂરી મેળવી તેઓની રહેમરાહે નોકરી આપવાની અરજી દફતરે કરી, તેઓને તા.૨૩/૦૭/૨૦૦૮ ના રોજના પત્રથી તેમના ઉપલબ્ધ સરનામે જાણ કરવામાં આવેલ હતી આ પત્ર જે સરનામે મોકલાવેલ છે તેની વિગતો પત્ર સ્વીકારનારનું નામ-સરનામું અને પત્ર સ્વીકારેલ છે તેવી સહી વાળી રસીદ (એકનોલેજમેન્ટ) ના દસ્તાવેજો (૩) અરજદારના પિતાએ લીધેલ લોન તથા તેની ચુકવણીના દસ્તાવેજો (૪) સંસ્થાએ તેમના જવાબના પેરા-સી માં જે રકમ દર્શાવેલ છે, તે રકમનું સંપૂર્ણ પુરાવા સહિતનું બીલ સામાવાળા રજૂ કરે તેવો હુકમ ફરમાવવા અરજ કરેલ છે.

૨. સામાવાળા સંસ્થાએ આંક-૧૯ થી વાંધા જવાબ રજૂ કરેલ છે અને તેમાં

જાણાવેલ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે સંબંધિત ખાતામાં સેન્ટ્રલ ઓફીસર વેલ્ફેર બ્રાન્ચમાં રહેમરાહે નોકરી અંગે અરજી તા.૧૮/૦૩/૨૦૦૮ ના રોજ એટલે કે ૬ માસની નકકી થયેલ નિયત સમય મર્યાદા બાદ આપેલ હતી. જેથી સક્ષમ સત્તાની મંજૂરી મેળવી, અરજી દફતરે કરી અરજદારને તા.૨૩/૦૭/૨૦૦૮ ના રોજના પત્રથી અરજદારના ઉપલબ્ધ સરનામે જાણ કરવામાં આવેલ હતી. આમ આ ફાઈલ આશરે ૧૫ વર્ષ પહેલાંની હોય તે હાલમાં મળી શકે તેમ નથી તેથી રજૂ કરી શકાય તેમ નથી. તે ઉપરાંત આ દસ્તાવેજ અરજદારને શા માટે જરૂરી છે તેની સ્પષ્ટતા કરેલ નથી. વધુમાં બીલમાં સંબંધિત વારસદારના સ્વ.પિતાની બાબતમાં ચુકવવા પાત્ર લેણી રકમ ગ્રેજ્યુઈટી, લેણી રજા, પગાર પંચનો તફાવત, જીઆઈએસ, પીએફ વિગેરે મળી કુલ રૂ.૧,૯૩,૧૮૫/- થતી હતી. જ્યારે સ્વ.ની નોકરી દરમ્યાન પે-રીકવરી પેટે રૂ.૧૫,૮૩૦/-, વેલ્ફેર લોન પેટે રૂ.૧,૦૧,૩૬૦/-, મ્યુનિસિપલ સપ્લાય પેટે રૂ.૧૫,૦૦૦/-, મ્યુનિસિપલ કો.ઓપ.બેન્ક પેટે રૂ.૨,૦૯,૧૯૯/- એમ કુલ રૂ.૩,૪૧,૩૮૯/- વસુલ કરવાની થતી હતી. આમ સ્વ.ની નોકરી દરમ્યાનની કુલ લેણી રકમ રૂ.૧,૯૩,૧૮૫/- સામે સ્વ.ની વસુલ કરવાની થતી રકમ રૂ.૩,૪૧,૩૮૯/- મુજબ બાકી વસુલ કરવાની થતી તફાવતની રકમ રૂ.૧,૪૭,૨૦૭/- સ્વ.ના સંબંધિત વારસદાર પાસેથી થાય છે, જે અરજદારે નૈતિક જવાબદારી સમજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચુકવી આપવાની તૈયારી દર્શાવેલ નથી. આથી યુનિયન તરફથી સંબંધિત વારસદારના સંબંધમાં બિનજરૂરી દસ્તાવેજો માંગતી અરજી કાયદેસર રીતે ચાલી શકે તેમ નથી તેથી ખર્ચ સહિત રદ કરવા અરજ કરેલ છે. વધુમાં જાણાવેલ છે કે અરજદારના મર્હુમ પિતાએ મ્યુનિસિપલ સપ્લાય સોસાયટી-મ્યુનિસિપલ કો.ઓપ.બેન્કમાંથી ક્યારે, કેટલી લોન લીધેલ હોય અને તેની ચુકવણી જે માધ્યમથી કરેલ હોય તે બાબતની તમામ પાસબુક તથા હિસાબો જે તે સંસ્થા પાસેથી મળી શકે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ સંસ્થા છે અને માંગેલ વિગતો આશરે ૧૫ વર્ષ પહેલાંની છે. વધુમાં જાણાવેલ છે કે અરજીમાં માંગેલ દસ્તાવેજો આર.ટી.આઈ. એક્ટ અન્વયે માંગી શકાય તેમ હતા અને છે. જેથી વૈકલ્પિક ઉપાય ઉપલબ્ધ હોય આ અરજી ચાલી શકે તેમ નથી. વધુમાં જાણાવેલ છે કે સંસ્થાના મેન્યુઅલ પાના નં.૧૦૩ ઉપર જાણાવેલ રેકર્ડ ડિપાર્ટમેન્ટના રેકર્ડની જાળવણીના હુકમ નં.૩૨ મુજબ

લીસ્ટ-એ ના દસ્તાવેજો કાયમી ધોરણે રાખવાના છે. માંગેલ દસ્તાવેજોજને તેમાં સમાવેશ થતો નથી, જેથી સબંધિત વારસદારના સબંધમાં બિનજરૂરી દસ્તાવેજો માંગણી અરજી ચાલી શકે તેમ ન હોય રદ કરવા અરજ કરેલ છે.

૩. અરજદાર તરફે પ્રતિનિધીશ્રી જે.એમ.સોલંકીને તથા સામાવાળા તરફે વિ.વ. શ્રી મિલન દવેને સાંભળ્યા. પ્રતિનિધીશ્રીએ તેમના અરજી મુજબના દસ્તાવેજો ન્યાય નિર્ણય માટે જરૂરી હોય અને તે સામાવાળા સંસ્થાના કબજામાં રહેતા હોય રજૂ કરવા હુકમ કરવા અરજ કરેલ છે. સામાવાળા તરફે વિ.વ.શ્રીએ સંસ્થાના રેકર્ડનું એ,બી,સી,ડી ફાઈલમાં વર્ગીકરણ કરવામાં આવતું હોવાનું જણાવી માંગેલ દસ્તાવેજો ૧૫ વર્ષ જૂના હોય, ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોય આ અરજી રદ કરવા જણાવેલ છે. સદર રેકર્ડના વર્ગીકરણનું લીસ્ટ આંક-૨૦ થી રજૂ કરેલ છે.

૪. ઉભય પક્ષકારોની દલીલો તથા કેસ રેકર્ડ વંચાણે લીધું. આ રેફરન્સના જે પ્રશ્નનો ન્યાય નિર્ણય કરવાનો છે તે આંક-૨ ની અનુસૂચિ વંચાણે લીધી. બીજા પક્ષકારે રજૂ કરેલ માંગણાનું નિવેદન વંચાણે લીધું. બીજા પક્ષકારે આંક-૧૬ ની અરજીમાં માંગેલ દસ્તાવેજો રેફરન્સની અનુસૂચિમાં જણાવેલ તકરારી પ્રશ્નોનો ન્યાય નિર્ણય કરવા માટે જરૂરી છે. અરજદારે વારસદાર તરીકે નોકરી મેળવવાની સમગ્ર ફાઈલ રજૂ કરાવવા માટેની જે દાદ માંગેલ છે તેમાં તેમને નિર્ણયની જાણ કરવાના દસ્તાવેજની એકનોલેજમેન્ટ વિગેરે વિગતોનો પણ સમાવેશ થઈ જાય છે. સામાવાળા સંસ્થાએ આંક-૧૫ ના લીસ્ટથી જે દસ્તાવેજો રજૂ કરેલ છે તે ધ્યાને લેતાં વારસદાર તરીકે નોકરી મેળવવા માટેની સમગ્ર ફાઈલ સામાવાળા સંસ્થા પાસે ઉપલબ્ધ હોવાનું માનવાને કારણ રહે છે.

૫. વધુમાં અરજદારે તેમના પિતાના લોન પેમેન્ટની વિગતની માંગણી કરેલ છે. આ સંદર્ભે સામાવાળાએ આંક-૧૯ થી રજૂ કરેલ વાંધા જવાબમાં જણાવેલ છે કે લોન આપેલ તે સંસ્થા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ બંને અલગ સંસ્થા છે. પરંતુ આંક-૧૪ થી જવાબના પેરા-સી ની હકીકત ધ્યાને લેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહુમ કર્મચારી પાસેથી વસુલ કરવાની રકમનો હિસાબ કરી તેમના વારસદાર પાસેથી રૂ.૧,૪૭, ૨૦૭/- વસુલ મેળવવાના થતા હોવાનું જણાવેલ છે. જેથી આ અંગેની માહિતી અને તેને લગતા

દસ્તાવેજો સંસ્થા આપી શકે તેમ છે. જેથી વારસદારની ફાઈલ અને મહુમના પિતાને ચુકવવાની થતી રકમ અને તેમની પાસેથી વસુલ લેવાની રકમ આ તમામ દસ્તાવેજો રેકર્ડ ઉપર આવે તો જ રેફરન્સની વિવાદીત તકરારનો ગુણદોષ ઉપર યોગ્ય રીતે ન્યાય નિર્ણય કરી શકાય તેમ છે. તે સંજોગોમાં રેકર્ડ ઉપરની તમામ હકીકતો અને દલીલો ધ્યાનમાં લેતાં ન્યાયના હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: હુકમ ::-

(૧) બીજા પક્ષકારની આંક-૧૬ ની અરજી "મંજૂર" કરવામાં આવે છે. આંક-૧૬ ની અરજીમાં જણાવેલ દસ્તાવેજો તથા હિસાબો આવતી મુદત તારીખ સુધીમાં રજૂ કરવા સામાવાળા સંસ્થાને હુકમ કરવામાં આવે છે.

(૨) જો દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો તે અંગે સામાવાળા સંસ્થાના જવાબદાર અધિકારીએ તે અંગેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કરવામાં આવે છે. જે દસ્તાવેજ નાશ કર્યા હોય તો તેનું નાશ કર્યા અંગેનું રજીસ્ટર અસલ બતાવી, તેની ખરી નકલ રજૂ કરવા હુકમ કરવામાં આવે છે.

(૩) આ અરજીના ખર્ચ અંગે કોઈ હુકમ નથી.

આ હુકમ આજરોજ ખુલ્લી અદાલતમાં વાંચી-સભળાવી, સહી કરી જાહેર કર્યો.

સ્થળ : અમદાવાદ.

તારીખ : ૧૨/૦૮/૨૦૨૫.

(હેમાંસુ અમૃતલાલ ભુતવાલા)

પ્રમુખ અધિકારી,

ઔદ્યોગિક ન્યાયપંચ, કોર્ટ નં.૪.

અમદાવાદ.

CODE-GJ00883